



LAKSHYA POWERTECH LIMITED

(Formerly Lakshya Powertech Private Limited)

CIN: L74900GJ2012PLC071218

GSTIN: 24AACCL3031F1Z4

E-mail: cs@lakshyapowertech.com

(M): 079-48007211

Regd. Office: A-620 & 621 Siddhivinayak Tower - A, B/H DCP Office,
Off. S.G. Highway, Makarba, Ahmedabad-380051, Gujarat, India.

Website: www.lakshyapowertech.com

September 03, 2025

To,
Listing Compliance Department,
National Stock Exchange of India Limited (SME Emerge),
Exchange Plaza, Plot No. C/1,
Block G, Bandra Kurla Complex,
Bandra (E), Mumbai-400 051
Company Symbol – LAKSHYA (NSE Emerge)

Dear Sir/ Madam,

Subject: Newspaper advertisement - advance notice of 13th Annual General Meeting (AGM) published in newspapers

Reference: *Relevant circular(s) issued by the Ministry of Corporate Affairs and the Securities & Exchange Board of India*

Pursuant to the above mentioned reference, we are submitting herewith copies of the newspapers publications published on September 03, 2025 w.r.t. Advance Notice of ensuing 13th Annual General Meeting of the company, in the following newspaper editions:

- 1) Business Standard – English Edition
- 2) Jai Hind – Gujarati Edition

Cutting of newspaper is annexed herewith.

We request you to kindly take note of above.

Thanking you,
Yours faithfully,
For Lakshya Powertech Limited

Akash Patel
Company Secretary &
Compliance Officer
M. No.: A68826

Encl.: A/a

PUBLIC NOTICE

Stalwart Investment Advisors LLP is surrendering its SEBI Research Analyst Reg. No. INH1000079252 & BASL Enlistment No. 5405. If anyone has any grievances, they can lodge the same at scs@sebi.gov.in within 30 days



LAKSHYA POWERTECH LIMITED

Registered Office: A-620 & 621 Siddhivinayak Tower-A/B DCP Office, Off. S.G. Highway, Makarba, Ahmedabad-380051, Gujarat, India.
Contact: 079-48007211, C.N. 17490062122
E-mail: cs@lakshyapowertech.com, Website: www.lakshyapowertech.com

NOTICE OF 13TH ANNUAL GENERAL MEETING

Notice is hereby given that the 13th Annual General Meeting (AGM) of the members of the company is scheduled to be held on Monday, September 29, 2025 at 03:00 PM IST through video conferencing (VC) or other audio visual means (OAVM) facility provided by NSDL in compliance with applicable provisions of the Companies Act, 2013 and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015. The notice is being issued in compliance with the provisions of the Companies Act, 2013 and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015. The notice is being issued in compliance with the provisions of the Companies Act, 2013 and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015. The notice is being issued in compliance with the provisions of the Companies Act, 2013 and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015.

The members holding shares as on the cut-off date i.e. Monday, September 22, 2025 including those who do not receive electronic copy of the annual report due to non-availability of their e-mail address with the company can exercise their right to vote through remote e-voting and e-voting during AGM. The members who have not received their e-mail address with the company are requested to register their e-mail address with the company. For registering e-mail address, the members are requested to follow the below step:

1. Preferably register the same with your depository participants OR send above documents + DP ID & Client ID, self-attested client master or consolidated account statement via e-mail to cs@lakshyapowertech.com & enward@kfinfintech.com.
2. Members may send an e-mail request to investor@nsdl.co.in for obtaining user ID and password by providing the details mentioned above, to receive login ID and password for e-voting.
3. Electronic copy of the annual report or 2024-25 including the notice which includes the process and manner of attending the AGM through VC and e-voting will be sent due to all the members whose e-mail addresses are registered with the company or depository participants. The annual report will also be available on the company's website at www.lakshyapowertech.com and stock exchange at www.nseindia.com and website of NSDL at www.evoting.nsdl.com.

Place : Ahmedabad,
Date : September 03, 2025

For Lakshya Powertech Limited, **Sd/-**
Akash Patel,
Company Secretary & Compliance Officer



BANK OF BARODA - BODEL BRANCH,
Janna Park Society, Bodeli, District: Vadodra,
Gujarat-391135, Email: bodeli@bankofbaroda.co.in,
M: 968768148

A notice is hereby given that the following Borrowers have defaulted in the repayment of principal and interest of the loans facility obtained by them from the Bank and the loans have been classified as Non-Performing Assets (NPA). The notices were issued to them under Section 13(2) of Securitization and Re-construction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 on their respective dates, but they have been returned unexecuted and as such they are hereby informed by way of this public notice as under:

Name of the Borrower/Guarantor	Nature and Type of facility	Limit	Rate of Interest (Annual with Monthly Rest)	Total Due as on 19.08.2025 (inclusive of interest up to 19.08.2025)	Security Agreement with brief description of securities.
Fakir Sakilshah	Home Loan	Rs. 7,80,399/-	(Applicable rate of interest 8.35% per annum which is sum of RBI repo rate 5.50% (at Present), Mark up of 2.65% (at Present) and Credit Spread of 0.20% (at Present) i.e. 8.35% (at Present).	Total dues as on 19.08.2025 Rs. 7,33,777.19	(Equitable mortgage) All that piece & parcel of Immovable Residential Property situated at R.S.No./Block No. 151 paki-1 land area measuring 0.40-78 HR sq.mtr (4178 Sq mtr) in the said land the scheme has been organized in the name and style of "SHIRADI" in which OT No. 18 area measuring 27.90 Sq mtr. Proportionate area measuring 14.50 sq mtr, total area measuring 42.05 sq mtr. Mortgage made at Jagdhan on 20th day of September 2023 of sale deed No 16 dated 01.02.2003 and registered at Bodeli Sop. By Mr. Fakir Sakilshah. The said property is bounded and surrounded as, East: Adj. Sumpna Road, West: Sumpna Road, North: Plot No.179, South: Plot No.180.

The steps are being taken for substituted service of notice. The above Borrower(s) and/or their Guarantor(s) (whenever applicable) are hereby called upon to make payment of outstanding amount within 60 days from the date of publication of this notice, failing which further steps will be taken after expiry of 60 days from the date of this notice under sub-section (4) of Section 13 of Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002.

Date: 03.09.2025 - Place: Bodeli

Authorised Officer - Bank of Baroda



SONATA SOFTWARE LIMITED
CIN: L72200MH1994PLC082110
Registered Office: 208, T.V Industrial Estate, 2nd Floor, S.K. Ashir, Marg, Worli, Mumbai - 400 030.
The Modernization Engineering Company
M/S. Sonata Software Limited, Global Village (Satyra Global City), RVCE Post, Kengeri, Hobli, Mysore Road, Bengaluru - 560059, India.
Tel: +91 80 6778 1000 Email: info@sonata-software.com
Website: www.sonata-software.com

Notice to Shareholders

'Saksham Niveshak' - 100-Day Campaign for Dividend Claims and KYC Updation
Notice is hereby given pursuant to directions issued by Investor Education and Protection Fund (IEPF), Ministry of Corporate Affairs, under Circular dated 16th July, 2025, 'Saksham Niveshak' - 100 days campaign' starting from 28th July, 2025 to 6th November, 2025 with the objective of creating awareness among shareholders to update their KYC details and claim their unpaid/unclaimed dividends before they get transferred to the Investor Education and Protection Fund ("IEPF").

In consistent with its ongoing efforts and as part of this campaign, Sonata Software Limited (the "Company") urges all its shareholders to take necessary steps to update their KYC details and claim their unpaid/unclaimed dividends by following the process as outlined below:

Holding Type	Documents to be submitted
For shares held in Demat Form	Update Know Your Customer (KYC) details including Permanent Account Number (PAN), Bank account details, choice of nomination and contact details (i.e., Email, mobile number, postal address) with your respective Depository Participant (DP).
For shares held in Physical Form	Submit the applicable Investor Service Request (ISR) forms (i.e., Form ISR - 1, Form ISR - 2 and Form ISR - 3 or Form No. SH-13 Nomination Form) duly filled as per the instructions stated therein along with supporting documents, if any, to the Company's Registrar and Share Transfer Agent. Forms are available on the Company's website at https://www.sonata-software.com/about-us/investor-relations

The details of shareholders whose dividends are lying unpaid/unclaimed are also available at the Investor Education and Protection Fund (IEPF) website at <https://www.sonata-software.com/about-us/investor-relations/corporate-governance>.

Further, the Company had also published a newspaper advertisement on 20th June, 2025 in 'Navshakti' (Regional newspaper) and in all India edition of 'Business Standard' Daily newspaper to the shareholders whose unpaid/unclaimed dividend and shares, pertaining to final dividend declared during financial year 2017-18 which are due for transfer to Investor Education and Protection Fund (IEPF), requesting to claim such unpaid/unclaimed dividends. Accordingly, Members are requested to claim such unpaid/unclaimed dividend to avoid such transfers on or before 9th September, 2025.

For any queries/issues related to unpaid/unclaimed dividend, shareholders are requested to contact our Registrar and Share Transfer Agent (RTA).

Kfin Technologies Limited, Unit-Sonata Software Limited,
Selenium Tower B, Plot No. 31 & 32, Gachibowli, Financial District, Nankramguda, Serilingampally, Hyderabad, Telangana - 500 032.
Toll free no. 1800 399 4001 Website: www.kfintech.com
Email ID: enward@kfinfintech.com

This notice is specifically intended for shareholders who have not updated their KYC details and are yet to claim their unpaid/unclaimed dividends.

For Sonata Software Limited **Sd/-**
Mangal Kulkarni
Company Secretary,
Place : Bengaluru
Compliance Officer and Head Legal

Date : 2nd September, 2025
Place : Bengaluru



M.P. MADHYA KSHETRA VIDYUT VITARAN CO. LTD.

Office of The General Manager, O&M Circle, Vidisha
E-mail: gmdisha@gmail.com

NOTICE INVITING E-TENDERS

Online tender are invited from eligible bidders who are registered on GC portal of MPKVCCL

Tender Description	Particulars	Approx. Value of Tender (In lakh)	Cost of Tender Document
GM/O&M PUR/3936/37 Dated 29.08.2025	Empanelment of Agencies for Restoration of Distribution Infrastructure during Emergency in (O&M) Circle Vidisha.	50.00	5900 + GST
GM/O&M PUR/3938-39 Dated 29.08.2025	Empanelment of Agencies for additional Augmentation of PTR at existing 33 KV S/Ss, and/or, LT Lines, DTR, Service Line and meter related works for any other associated works as per SOR specifications in (O&M) Circle Vidisha.	950.00	11800 + GST

Date of sale of Bid documents : 01.09.2025, 9.00 Hrs. Up to 15.09.2025 12.30 Hrs.
Bid Submission last Date : 15.09.2025, 12.30 Hrs.
Bid opening Date : 16.09.2025 at 12.30 Hrs.
Other details, terms and conditions are available on company website : <https://portal.mpcz.in> & <https://tenders.gov.in> or the under signed office.
M.P. Madhyam 121606/2025

GENERAL MANAGER (O&M)



SUPER SPINNING MILLS LIMITED

CIN: L17117G12962POL001200

Regd. Off.: ELGI TOWERS, PB: No. 7113, Green Fields,

Pulitakulam Road, Coimbatore - 641045 | Phone: 0422-2311711

Email: investors@ssh.saregali.com Website: www.superspinning.com

NOTICE OF POSTAL BALLOT / E-VOTING

Members are hereby informed that pursuant to Section 110 and other applicable provisions, if any, of the Companies Act, 2013 (the "Act"), read with Rule 22 of the Companies (Management and Administration) Rules, 2014 (the "Rules") (including any statutory modifications or re-enactments) thereof for the time being in force, read with the General Circular No. 14/2020 dated 08th April 2020, General Circular No. 19/2020 dated 19th September 2020 and other relevant circulars, including General Circular No. 9/2024 dated 19th September 2024 issued by the Ministry of Corporate Affairs ("MCA") (hereinafter collectively referred to as "MCA Circulars"), the Company has completed the dispatch of the Postal Ballot Notice on Tuesday, 2nd September 2025 through e-mail to all its Shareholders, who have registered their e-mail IDs as on 29th August 2025 seeking the consent of the Members through voting by electronic means to transact the Postal Ballot Notice set out in the Postal Ballot Notice dated 29th August 2025 in respect of the Resolution.

1. To consider and grant approval to sell the land and/or building situated at 'Elgi Towers', PB: No. 7113, Green Fields, Pulitakulam Road, Coimbatore - 641045, Tamil Nadu, measuring 17.14 cents, to Mr. Sumanth Ramnarath, Promoter of the Company. (Ordinary Resolution)
2. To consider and grant approval to sell the land and/or building situated at 'Elgi Towers', PB: No. 7113, Green Fields, Pulitakulam Road, Coimbatore - 641045, Tamil Nadu, measuring 4.28 cents, to Elgi Electric and Industries Limited, a company belonging to the Promoter Group of the Company. (Ordinary Resolution)

In pursuance of Section 108 of the Companies Act, 2013 read with Rule 102 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015 and the aforesaid MCA Circulars, the Company has engaged the services of MUFG Intime India Private Limited ("MUFG") to provide remote e-voting facility to the Members of the Company through their Instavote e-voting platform at the link <https://instavote.lintime.co.in> for passing of the Resolution mentioned in the Postal Ballot Notice. The remote e-voting commences from 9:00 AM Indian Standard Time ("IST") on Wednesday, 3rd September 2025, and ends at 5:00 PM IST on Thursday, 2nd October 2025. The e-voting module shall be disabled by MUFG thereafter and no voting will be possible beyond the said date. Please note that in compliance with MCA Circulars, there will be no dispatch of physical copies of Postal Ballot Notice and Postal Ballot forms to the Shareholders of the Company. Members are therefore requested to communicate their assent or dissent through the remote e-voting facility only.

Members whose names are recorded in the Register of Members of the Company or in the Register of Beneficial Owners maintained by the Depositories as on the cut-off date i.e., Friday, 29th August 2025, only will be entitled to cast their votes by remote e-voting. The persons who are not Members of the Company as on the cut-off date should treat this notice as informative only.

Mr. M.D. Selvaraj, FCS, Managing Partner of M/s. MDS & Associates LLP Company Secretaries, Coimbatore has been appointed as the Scrutinizer for conducting the Postal Ballot voting process in a fair and transparent manner. The results of the Postal Ballot e-voting shall be announced within 2 working days from the closure of the e-voting platform and the same shall be intimated to SEBI Limited (BSE) and the National Stock Exchange of India Limited (NSE) and shall also be uploaded on the Company's website www.superspinning.com and on the MUFG's website viz., <https://instavote.lintime.co.in>

If you have not registered your e-mail address with the Company/RTA/Depositories you may please follow the instructions given below for obtaining login details for e-voting:

1. For Shareholders - Please provide necessary details like Folio No., Name of Shareholder, scanned copy of the share certificate (front and back), Permanent Account Number (self-attested scanned copy of PAN card), e-SHAHRUK (Self-attested scanned copy of Aadhar Card) by email to Company's Registrar and Share Transfer Agent at investors@ssh.saregali.com or to the Company at investors@ssh.saregali.com.
2. For Demat shareholders - Please update your email ID & mobile no. with your respective Depository Participants ("DP").

For any queries relating to voting by electronic means, shareholders are requested to refer the Frequently Asked Questions (FAQs) and Instavote e-voting manual available at <https://instavote.lintime.co.in>, under Help Section or write an email at enotes@ssh.saregali.com or call at Tel: 022-4918 6000 or contact M/s. MUFG Intime India Private Limited, having its office at 'Surya', 35, Mayflower Avenue, behind Senthil Nagar, Sowripalayam Road, Coimbatore - 641028 or their telephone number at Tel: 0422-253683/36 or Mrs. Sabeetha Devarajan, Company Secretary at the Company's Registrar Office at 'Elgi Towers', PB: No. 7113, Green Fields, Pulitakulam Road, Coimbatore - 641045; or at Mr. Madhavan - 022-2311711; or e-mail at investors@ssh.saregali.com

The Notice of the Postal Ballot is available on the Company's website www.superspinning.com, MUFG's website <https://instavote.lintime.co.in> and on the websites of NSE at www.nseindia.com and BSE at www.bseindia.com.

By Order of the Board
For Super Spinning Mills Limited
Sd/-
Sabeetha Devarajan
Company Secretary

Place: Coimbatore
Date: 3rd September 2025

AG VENTURES LIMITED

(FORMERLY ORIENTAL CARBON & CHEMICALS LIMITED)

Corporate Identity Number (CIN) - L24297GJ1978PL133845

Regd. Off: Plot No. 30-33, Kachchh, Gujarat - 370415

Email ID: investor@agventures.co.in, Tel: +91 120 2446850

Website: www.agventuresltd.com

NOTICE

(for attention of Equity Members of the Company)

Subject: Transfer of Equity Shares of the Company to the Investor Education and Protection Fund Authority (IEPF)

This Notice is hereby published pursuant to the provisions of Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, as amended from time to time (the "IEPF Rules"). As per Section 124(6) of the Companies Act, 2013 read with the above referred Rules, all shares in respect of which dividends declared by the Company has not been claimed or remained unpaid for seven consecutive years or more since the payment of interim dividend for the financial year 2018-19 are liable to be transferred by the Company to the Investor Education and Protection Fund (IEPF).

In accordance with the various requirements as set out in the Rules, the Company has already communicated individually to the Members that equity shares in respect of which dividend declared for the financial year 2018-19 to the Company for the financial year 2018-19 to IEPF, without any further notice by the following due process as mentioned below:

1. In case of shares held in Physical form: by issuing duplicate share certificates on behalf of the concerned members and then transferring the same to IEPF Authority.

2. In case of shares held in Demat form: by transferring the shares directly to demat account of IEPF Authority in the name of Depository Participants.

Concerned Members can claim both unpaid/unclaimed dividends and shares transferred to the IEPF Authority after following the procedure prescribed in the IEPF Rules.

In case the Members have any queries/clarifications on the subject matter and Rules, they may contact the Registrar and Transfer Agent of the Company at MUFG Intime India Pvt. Ltd., Rasco Court, 5th floor, 20, Sir N. Mukherjee Road, Kolkata - 700071, West Bengal, Tel: +91 033-6906-6200; E-mail: kolkata@ssh.saregali.com.

The Notice may also be accessed on the Company's website at www.agventuresltd.com and may also be assessed on Stock Exchanges Websites at www.bseindia.com.

For AG Ventures Limited (formerly Oriental Carbon & Chemicals Limited)

Place : Noida
Dated : 02.09.2025

Sd/-
Vinod
Company Secretary



Arisinfra Solutions Limited

(Formerly known as Arisinfra Solutions Private Limited)

Reg. Office: Unit No. A-404 to 407, Ground Floor A-Wing, Raj Gaudi House, Phoenix Market City, L.S.S. Marg, Kurla West, Mumbai - 400 070, Maharashtra, India.

CIN: L15109AH2021PLC354997; Web: www.arisinfra.com; Email: cs@arisinfra.com

INFORMATION REGARDING 4TH ANNUAL GENERAL MEETING

The 4th Annual General Meeting ("AGM") of the Members of Arisinfra Solutions Limited ("Company") will be held on Monday, September 29, 2025 at 03:00 p.m. (IST) through Video Conferencing (VC) / Other Audio Visual Means ("OAVM") in compliance with all the applicable provisions of the Companies Act, 2013 and the rules made thereunder and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations") read with all the applicable circulars on the matter issued by the Ministry of Corporate Affairs ("MCA") and the Securities and Exchange Board of India ("SEBI"), to transact the business as set out in the notice calling the AGM.

Electronic dissemination of Notice and Annual Report
In compliance with the above Circulars, the Notice of the AGM and Annual Report for FY 2024-25 will be sent electronically by the Company to those Members who have registered their e-mail addresses with the Depository Participants ("DPs"), or the Company or MUFG Intime India Private Limited, (Formerly Intime India Private Limited) the Company's Registrar and Share Transfer Agent ("RTA") and the same will also be available on the website of the Company (www.arisinfra.com), BSE Limited (www.bseindia.com), National Stock Exchange of India Limited (www.nseindia.com). The Notice of AGM will also be posted available on the website of National Securities Depository Limited at www.evoting.nsdl.com, being the agency appointed by the Company for facilitating VCO/AVM and voting by electronic means, including remote e-voting and e-voting during the AGM ("e-voting").

In addition, pursuant to Regulations 36(1) of SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015, a letter will be sent to Members whose e-mail IDs are not yet registered providing a weblink where the Annual Report will be uploaded on websites. The Company shall send Annual Report for FY 2024-25, to only those members who specifically request the same by sending an email to cs@arisinfra.com by mentioning their Name, Folio No. and DP/ID and Client ID.

Registration of E-mail address

All the members are requested to register their e-mail ID. The Members of the Company who have not registered their e-mail address with their Depository Participants, are requested to register their e-mail address with the Depository Participants through whom they maintain their demat accounts.

Manner of casting votes through e-voting and attending the AGM through VCO/AVM:

The Company will be providing remote e-voting facility of NSDL to all its members to cast their vote on all resolutions set out in the notice of the 4th AGM. Detailed procedure for remote e-voting before AGM/e-voting during the AGM will be provided in the Notice.

Members attending the AGM through VCO/AVM will be counted for the purpose of exercising the quorum under Section 103 of the Companies Act, 2013.

Members are requested to carefully read all the notes set out in the Notice of the 4th AGM and in particular, instruction of joining the AGM, member for casting vote through remote e-voting/e-voting during the AGM.

For Arisinfra Solutions Limited (Formerly known as Arisinfra Solutions Private Limited)

Sd/-
Ronak Kishor Morbia
Chairman and Managing Director
DIN: 08052500

Date: September 1, 2025
Place: Mumbai

Sd/-
Ronak Kishor Morbia
Chairman and Managing Director
DIN: 08052500

Sd/-
Ronak Kishor Morbia
Chairman and Managing Director
DIN: 08052500

Sd/-
Ronak Kishor Morbia
Chairman and Managing Director
DIN: 08052500

Sd/-
Ronak Kishor Morbia
Chairman and Managing Director
DIN: 08052500

Sd/-
Ronak Kishor Morbia
Chairman and Managing Director
DIN: 08052500

Sd/-
Ronak Kishor Morbia
Chairman and Managing Director
DIN: 08052500

Sd/-
Ronak Kishor Morbia
Chairman and Managing Director
DIN: 08052500

Sd/-
Ronak Kishor Morbia
Chairman and Managing Director
DIN: 08052500

Sd/-
Ronak Kishor Morbia
Chairman and Managing Director
DIN: 08052500

Sd/-
Ronak Kishor Morbia
Chairman and Managing Director
DIN: 08052500

Sd/-
Ronak Kishor Morbia
Chairman and Managing Director
DIN: 08052500

Sd/-
Ronak Kishor Morbia
Chairman and Managing Director
DIN: 08052500

Sd/-
Ronak Kishor Morbia
Chairman and Managing Director
DIN: 08052500

Sd/-
Ronak Kishor Morbia
Chairman and Managing Director
DIN: 08052500

Sd/-
Ronak Kishor Morbia
Chairman and Managing Director
DIN: 08052500

Sd/-
Ronak Kishor Morbia
Chairman and Managing Director
DIN: 08052500

Sd/-
Ronak Kishor Morbia
Chairman and Managing Director
DIN: 08052500

Sd/-
Ronak Kishor Morbia
Chairman and Managing Director
DIN: 08052500

Sd/-
Ronak Kishor Morbia
Chairman and Managing Director
DIN: 08052500

Sd/-
Ronak Kishor Morbia
Chairman and Managing Director
DIN: 08052500

Sd/-
Ronak Kishor Morbia
Chairman and Managing Director
DIN: 08052500

Sd/-
Ronak Kishor Morbia
Chairman and Managing Director
DIN: 08052500

Sd/-
Ronak Kishor Morbia
Chairman and Managing Director
DIN: 08052500

Sd/-
Ronak Kishor Morbia
Chairman

પક્ષી અથડાતાં ઈમરજન્સી લેન્ડિંગ

ઈન્ડિગોની ૧૬૫ પેસેન્જરને લઈ જતી ફ્લાઈટમાં મોટી દુર્ઘટના ટળી

મહારાષ્ટ્ર, તા.૨ મહારાષ્ટ્રના નાગપુરથી કોલકાતા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ માંડ માંડ મોટી દુર્ઘટનાનો ભોગ બનતા અટકી છે.

ઉડાન સમયે ફ્લાઈટ સામે અચાનક પક્ષી અથડા્યું હતું. આ અકસ્માત એટલો ભયાવહ હતો તે ફ્લાઈટ યૂર્ટન લઈ નાગપુર પરત આવવુ પડ્યું. નાગપુર એરપોર્ટ પર ફ્લાઈટનું લેન્ડિંગ કરાવ્યું હતું. નાગપુર એરપોર્ટના વરિષ્ઠ અધિકારીએ આ અંગે માહિતી આપી હતી.

નાગપુર એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યા પ્રમાણે, ફ્લાઈટે આજે સવારે નાગપુરથી

કોલકાતા જવા ઉડાન ભરી હતી.

પરંતુ ઉડાન ભયાની થોડી

પાયલટે સાવચેતીને ધ્યાનમાં લેતાં ફ્લાઈટ પાછી વાળી હતી અને તેનું નાગપુરમાં તાત્કાલિક ધોરણે લેન્ડિંગ કરાવ્યું

ક્ષણોમાં જ વિમાન અચાનક પક્ષી સાથે અથડા્યું હતું. આ ઘ્વનમાં ૧૬૦-૧૬૫ લોકો સવાર હતાં. પાયલટે સાવચેતીને ધ્યાનમાં લેતાં ફ્લાઈટ પાછી વાળી હતી અને તેનું નાગપુરમાં તાત્કાલિક ધોરણે લેન્ડિંગ કરાવ્યું હતું. આજ માટે આ ફ્લાઈટ રદ કરવામાં

આવી છે. નાગપુર એરપોર્ટના સિનિયર એરપોર્ટ ડિરેક્ટર આબિદ રૂહીએ જણાવ્યું હતું કે, અમે ઘટનાનું નીરક્ષણ કરી રહ્યા છીએ. વિમાનનું પજા પરીક્ષણ કરી રહ્યા છે. પેસેન્જર્સની સલામતીના પગલે આજની આ ફ્લાઈટ રદ કરવામાં આવી છે.



પંજાબમાં ભારે વરસાદને કારણે િજલ્લામાં પુરની ગંભીર સ્થિતિ સર્જાયેલી છે. અત્યાર સુધીમાં ૨૮ લોકોના મોત થયા છે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ધમુના નદીનું જળસ્તર ભયજનક સપાટીને પાર કરતાં નીચાણવાળા વિસ્તારોમાં પુરના પાણી ફરી વળતા અનેક કોલોનીઓ ખાલી કરાવાઈ છે. તસ્વીરમાં લોહા પુલ (આયન બ્રીજ) નજીક પુરના પાણીમાં ફસાયેલી એક સાયકલ રિશ્તાને લોકો ધક્કા મારીને બહાર કાઢી રહ્યા છે.

દેશની તમામ માતા-બહેનનું અપમાન

અપમાનજનક ટિપ્પણી બદલ એનડીએ દ્વારા આવતીકાલે બિહાર બંધનું એલાન

બિહાર, તા. ૨ PM નરેન્દ્ર મોદીના માતા વિરૂદ્ધ ગતમહિને વિપક્ષની રેલીમાં કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી બદલ એનડીએ દ્વારા ચાર સપ્ટેમ્બરે બિહાર બંધનું એલાન કરવામાં આવ્યું છે. ચાર સપ્ટેમ્બરના રોજ સવારે ૭ વાગ્યાથી બોરના ૧૨ વાગ્યા સુધી બિહાર બંધ રાખવાની જાહેરાત કરી છે. એનડીએ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતા વિરૂદ્ધ આપવામાં આવેલા નિવેદન વિરુદ્ધ પજા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. NDAએ આ મામલે વડાપ્રધાન મોદીએ આજે મંગળવારે બિહાર રાજ્ય જીવિકા મંત્રી સામ સહકારી સંઘ લિમિટેડનું વર્ચુઅલી ઉદ્ઘાટન કરતાં સ્વર્ગવાસી માતા વિરૂદ્ધ અપશબ્દો બોલવા બદલ દુ:ખ વ્યક્ત કર્યું હતું.

ગત મહિને વિપક્ષના ગઠબંધન આરજેડી-કોંગ્રેસની રેલીમાં વડાપ્રધાન મોદીના માતા વિરૂદ્ધ અપશબ્દો બોલવા પર આજે પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, બિહારમાં આરજેડી-કોંગ્રેસ મંચ પરથી મારા માતા વિરૂદ્ધ જે આરજેડી-કોંગ્રેસની રેલીમાં વડાપ્રધાન મોદીના માતા વિરૂદ્ધ અપશબ્દો બોલવા પર આજે પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, બિહારમાં આરજેડી-કોંગ્રેસ મંચ પરથી મારા માતા વિરૂદ્ધ જે

K. Z. LEASING AND FINANCE LIMITED
Regd. Office: Deshna Chambers, B/H. Kadva Patidar Wadi, Usmannpur, Ashram Road, Ahmedabad - 380014. || CIN: L65910GJ1986PLC00864
NOTICE FOR ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND E-VOTING
 NOTICE is hereby given that the 39th Annual General Meeting of the Members of K Z Leasing And Finance Limited will be held on **Saturday, 27th September, 2025 at 10.00 a.m.** at the registered office of the Company at 1st Floor, Deshna Chamber, B/H. Kadva Patidar Wadi, Usmannpur, Ahmedabad -380014, to transact the business set out in the Notice dated 2nd September, 2025.
 The Notice of the 39th AGM and Annual Report for the financial year 2024-25 have been sent by email to all those members of the Company whose email IDs are registered with the Company/Depository Participants. Members desiring to receive the said documents in physical form will continue to get the same in physical form free of cost upon request.
 NOTICE is hereby further given that pursuant to Section 91 of the Companies Act, 2013 read with rules made there under and as per Regulation 42 of SEBI (LODR) Regulations, 2015, the Register said Members and the Share Transfer Agents who have already cast their vote by remote e-voting prior to the AGM can attend the AGM but shall not be entitled to cast their vote again at AGM.
 1) Date of Completion of dispatch of Notice of AGM : 02nd September, 2025
 2) Date & Time of commencement of Remote e-voting : 24th September, 2025 at 9.00 am
 3) Date & Time of end of Remote e-voting : 26th September, 2025 at 5.00 pm
 4) Cut-off date for determining rights of entitlement of Remote e-voting : 21st September, 2025
 Those persons who have acquired shares and have become members of the Company after dispatch of notice of AGM by the Company and whose names appear in the Register of Members of the Company in the statement of beneficial owners maintained by depositories as on cutoff date can exercise their voting rights through Remote e-voting by following the procedure as mentioned in the said Notice of AGM
 6) Remote e-voting shall not be allowed beyond : After 5:00 p.m. on 26th September, 2025
 7) Manner of casting vote on resolutions at the venue of AGM : The facility of voting through "Ballot Paper" shall be made available at the venue of AGM. E-voting facility will not be available at the venue of AGM. Members who have already cast their vote by remote e-voting prior to the AGM can attend the AGM but shall not be entitled to cast their vote again at AGM.
 8) Notice of 39th AGM is available on website : www.kzgroup.in
 9) Contact details of person responsible to address the grievances connected with remote e-voting : Name of Official- Mr. Rakesh Davi, Designation - Manager, Address - 25th Floor, A Wing, Marathon Futurax, Mafatali Mills Compound, NM Joshi Marg, Lower Phase (E), Mumbai - 400 015, Email id- helpdesk.evoting@cdsindia. com Phone No. - 1800210911
 Date : 02/09/2025 By Order of the Board For, K.Z. Leasing & Finance Ltd.
 Place : Ahmedabad **Pravinkumar K. Patel** (Managing Director)

TRANS INDIA HOUSE IMPEX LTD
 CIN: L74110GJ1987PLC152434
 Registered Office: B-1101, Titanium Square, B/H. Sarveshwar Tower, Opp. B.M.W. Show Room, Thaltej, Ahmedabad - 380 054, Gujarat, INDIA
 Email: compliance@tihl.co.in, Ph.: +91-79-46008108 Web: www.tihl.co.in
NOTICE OF THE 37TH ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND E-VOTING INFORMATION
 Notice is hereby given that the 37th Annual General Meeting (AGM) of the Equity Shareholders of Trans India House Impex Limited ("the Company") will be held on Thursday, 25th September 2025 at 04:00 PM IST through Video Conferencing ("VC") or Other Audio Visual Means ("OAVM") to transact the businesses as set out in the Notice of the 37th AGM in compliance with the applicable provisions of the Companies Act, 2013 ("Act") & Rules framed thereunder and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with all applicable Circulars on the matter issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars") and Securities and Exchange Board of India ("SEBI Circular") to transact the businesses as mentioned in the 37th AGM Notice, without the physical presence of the Members at a common venue.
 Pursuant to Section 101 of the Act read with Rule 18 of the Companies (Management and Administration) Rules, 2014, Regulation 36 of the Listing Regulations, Secretarial Standard on General Meetings (SS-2) and in compliance with the MCA Circulars and SEBI Circular, the Notice of 37th AGM along with the Annual Report 2024-25 have been sent on Tuesday, 2nd September 2025 by email to those members whose email addresses are registered with the Company / Registrar and Share Transfer Agent / Depositories. The requirements of sending a physical copy of the Notice of the 37th AGM and the Annual Report 2024-25 to the Members have been dispensed with vide MCA Circulars and SEBI Circulars. Members are hereby informed that the said AGM Notice is also available on the Company's website www.tihl.co.in, website of the Stock Exchange i.e. BSE Limited at www.bseindia.com and on the website of National Securities Depository Limited at www.evoting.nsdl.com.
 Pursuant to Section 108 of the Act read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time, Regulation 44 of the Listing Regulations and SS-2, the Company is providing its members the e-voting facility to cast their votes on the resolution set out in the AGM Notice by using an electronic voting system from a place other than the venue of the AGM (i.e. remote e-voting). The Company will also provide a facility of e-voting to members during the AGM, who have not cast their vote by remote e-voting. The Company has entered into an arrangement with NSDL to provide remote e-voting. A person whose name appears on the Register of Members / Beneficial Owners as on the cut-off date i.e. Thursday, 18th September 2025 shall only be entitled to avail of the remote e-voting facility or e-voting during the AGM. The documents referred to in the Notice of the AGM are available electronically for inspection by the members from the date of circulation of the Notice of the AGM. Members seeking to inspect such documents can send an e-mail to compliance@tihl.co.in.
 The remote e-voting period will commence on Monday, 22nd September 2025 (09:00 AM IST) and will end on Wednesday, 24th September 2025 (05:00 PM IST). During this period, the members of the Company may cast their votes electronically on items mentioned in the AGM Notice. The remote e-voting shall be disabled for voting by NSDL after 05:00 P.M. IST on Wednesday, 24th September 2025 (05:00 PM IST). Once the vote on a resolution is cast by a member, any subsequent change shall not be allowed. The voting rights of the members shall be in proportion to their shares in paid-up share capital of the Company as on the cut-off date i.e. Thursday, 18th September 2025. The detailed instructions relating to remote e-voting and e-voting during the AGM are provided in the Notices forming part of the 37th AGM Notice.
 Only those Members, who will be present in the AGM through VC / OAVM and have not cast their votes on the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system available during the 37th AGM. Members who have cast their vote through remote e-voting will be eligible to attend the AGM. However, they will not be eligible to vote at the AGM.
 Any person, who becomes a member of the Company after sending of the AGM Notice by email and holding shares as on Thursday, 18th September 2025, may refer to the AGM Notice and obtain the login ID and password from the Company by sending a request at compliance@tihl.co.in. Members whose email id is not registered, may refer to Process for those shareholders whose email addresses are not registered with the Depositories/Company/RTA for obtaining login credentials for e-voting" as detailed in 37th AGM Notice.
 In case of any query relating to remote e-voting you may refer the FAQs for Shareholders and refer to e-voting manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no. 1800 1020 990 and 1800224430 or send a request at evoting@nsdl.co.in.
 Pursuant to Section 91 of the Act read with Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 42 of the Listing Regulations, the Register of Members and Share Transfer Books of the Company shall remain closed from Friday, 19th September 2025 to Thursday, 25th September 2025 (both days inclusive) for the purpose of 37th AGM.

TRANS INDIA HOUSE IMPEX LTD
 CIN: L74110GJ1987PLC152434
 Registered Office: B-1101, Titanium Square, B/H. Sarveshwar Tower, Opp. B.M.W. Show Room, Thaltej, Ahmedabad - 380 054, Gujarat, INDIA
 Email: compliance@tihl.co.in, Ph.: +91-79-46008108 Web: www.tihl.co.in
NOTICE OF THE 37TH ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND E-VOTING INFORMATION
 Notice is hereby given that the 37th Annual General Meeting (AGM) of the Equity Shareholders of Trans India House Impex Limited ("the Company") will be held on Thursday, 25th September 2025 at 04:00 PM IST through Video Conferencing ("VC") or Other Audio Visual Means ("OAVM") to transact the businesses as set out in the Notice of the 37th AGM in compliance with the applicable provisions of the Companies Act, 2013 ("Act") & Rules framed thereunder and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with all applicable Circulars on the matter issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars") and Securities and Exchange Board of India ("SEBI Circular") to transact the businesses as mentioned in the 37th AGM Notice, without the physical presence of the Members at a common venue.
 Pursuant to Section 101 of the Act read with Rule 18 of the Companies (Management and Administration) Rules, 2014, Regulation 36 of the Listing Regulations, Secretarial Standard on General Meetings (SS-2) and in compliance with the MCA Circulars and SEBI Circular, the Notice of 37th AGM along with the Annual Report 2024-25 have been sent on Tuesday, 2nd September 2025 by email to those members whose email addresses are registered with the Company / Registrar and Share Transfer Agent / Depositories. The requirements of sending a physical copy of the Notice of the 37th AGM and the Annual Report 2024-25 to the Members have been dispensed with vide MCA Circulars and SEBI Circulars. Members are hereby informed that the said AGM Notice is also available on the Company's website www.tihl.co.in, website of the Stock Exchange i.e. BSE Limited at www.bseindia.com and on the website of National Securities Depository Limited at www.evoting.nsdl.com.
 Pursuant to Section 108 of the Act read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time, Regulation 44 of the Listing Regulations and SS-2, the Company is providing its members the e-voting facility to cast their votes on the resolution set out in the AGM Notice by using an electronic voting system from a place other than the venue of the AGM (i.e. remote e-voting). The Company will also provide a facility of e-voting to members during the AGM, who have not cast their vote by remote e-voting. The Company has entered into an arrangement with NSDL to provide remote e-voting. A person whose name appears on the Register of Members / Beneficial Owners as on the cut-off date i.e. Thursday, 18th September 2025 shall only be entitled to avail of the remote e-voting facility or e-voting during the AGM. The documents referred to in the Notice of the AGM are available electronically for inspection by the members from the date of circulation of the Notice of the AGM. Members seeking to inspect such documents can send an e-mail to compliance@tihl.co.in.
 The remote e-voting period will commence on Monday, 22nd September 2025 (09:00 AM IST) and will end on Wednesday, 24th September 2025 (05:00 PM IST). During this period, the members of the Company may cast their votes electronically on items mentioned in the AGM Notice. The remote e-voting shall be disabled for voting by NSDL after 05:00 P.M. IST on Wednesday, 24th September 2025 (05:00 PM IST). Once the vote on a resolution is cast by a member, any subsequent change shall not be allowed. The voting rights of the members shall be in proportion to their shares in paid-up share capital of the Company as on the cut-off date i.e. Thursday, 18th September 2025. The detailed instructions relating to remote e-voting and e-voting during the AGM are provided in the Notices forming part of the 37th AGM Notice.
 Only those Members, who will be present in the AGM through VC / OAVM and have not cast their votes on the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system available during the 37th AGM. Members who have cast their vote through remote e-voting will be eligible to attend the AGM. However, they will not be eligible to vote at the AGM.
 Any person, who becomes a member of the Company after sending of the AGM Notice by email and holding shares as on Thursday, 18th September 2025, may refer to the AGM Notice and obtain the login ID and password from the Company by sending a request at compliance@tihl.co.in. Members whose email id is not registered, may refer to Process for those shareholders whose email addresses are not registered with the Depositories/Company/RTA for obtaining login credentials for e-voting" as detailed in 37th AGM Notice.
 In case of any query relating to remote e-voting you may refer the FAQs for Shareholders and refer to e-voting manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no. 1800 1020 990 and 1800224430 or send a request at evoting@nsdl.co.in.
 Pursuant to Section 91 of the Act read with Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 42 of the Listing Regulations, the Register of Members and Share Transfer Books of the Company shall remain closed from Friday, 19th September 2025 to Thursday, 25th September 2025 (both days inclusive) for the purpose of 37th AGM.

NOTICE OF THE 37TH ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND E-VOTING INFORMATION
 Notice is hereby given that the 37th Annual General Meeting (AGM) of the Equity Shareholders of Trans India House Impex Limited ("the Company") will be held on Thursday, 25th September 2025 at 04:00 PM IST through Video Conferencing ("VC") or Other Audio Visual Means ("OAVM") to transact the businesses as set out in the Notice of the 37th AGM in compliance with the applicable provisions of the Companies Act, 2013 ("Act") & Rules framed thereunder and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with all applicable Circulars on the matter issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars") and Securities and Exchange Board of India ("SEBI Circular") to transact the businesses as mentioned in the 37th AGM Notice, without the physical presence of the Members at a common venue.
 Pursuant to Section 101 of the Act read with Rule 18 of the Companies (Management and Administration) Rules, 2014, Regulation 36 of the Listing Regulations, Secretarial Standard on General Meetings (SS-2) and in compliance with the MCA Circulars and SEBI Circular, the Notice of 37th AGM along with the Annual Report 2024-25 have been sent on Tuesday, 2nd September 2025 by email to those members whose email addresses are registered with the Company / Registrar and Share Transfer Agent / Depositories. The requirements of sending a physical copy of the Notice of the 37th AGM and the Annual Report 2024-25 to the Members have been dispensed with vide MCA Circulars and SEBI Circulars. Members are hereby informed that the said AGM Notice is also available on the Company's website www.tihl.co.in, website of the Stock Exchange i.e. BSE Limited at www.bseindia.com and on the website of National Securities Depository Limited at www.evoting.nsdl.com.
 Pursuant to Section 108 of the Act read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time, Regulation 44 of the Listing Regulations and SS-2, the Company is providing its members the e-voting facility to cast their votes on the resolution set out in the AGM Notice by using an electronic voting system from a place other than the venue of the AGM (i.e. remote e-voting). The Company will also provide a facility of e-voting to members during the AGM, who have not cast their vote by remote e-voting. The Company has entered into an arrangement with NSDL to provide remote e-voting. A person whose name appears on the Register of Members / Beneficial Owners as on the cut-off date i.e. Thursday, 18th September 2025 shall only be entitled to avail of the remote e-voting facility or e-voting during the AGM. The documents referred to in the Notice of the AGM are available electronically for inspection by the members from the date of circulation of the Notice of the AGM. Members seeking to inspect such documents can send an e-mail to compliance@tihl.co.in.
 The remote e-voting period will commence on Monday, 22nd September 2025 (09:00 AM IST) and will end on Wednesday, 24th September 2025 (05:00 PM IST). During this period, the members of the Company may cast their votes electronically on items mentioned in the AGM Notice. The remote e-voting shall be disabled for voting by NSDL after 05:00 P.M. IST on Wednesday, 24th September 2025 (05:00 PM IST). Once the vote on a resolution is cast by a member, any subsequent change shall not be allowed. The voting rights of the members shall be in proportion to their shares in paid-up share capital of the Company as on the cut-off date i.e. Thursday, 18th September 2025. The detailed instructions relating to remote e-voting and e-voting during the AGM are provided in the Notices forming part of the 37th AGM Notice.
 Only those Members, who will be present in the AGM through VC / OAVM and have not cast their votes on the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system available during the 37th AGM. Members who have cast their vote through remote e-voting will be eligible to attend the AGM. However, they will not be eligible to vote at the AGM.
 Any person, who becomes a member of the Company after sending of the AGM Notice by email and holding shares as on Thursday, 18th September 2025, may refer to the AGM Notice and obtain the login ID and password from the Company by sending a request at compliance@tihl.co.in. Members whose email id is not registered, may refer to Process for those shareholders whose email addresses are not registered with the Depositories/Company/RTA for obtaining login credentials for e-voting" as detailed in 37th AGM Notice.
 In case of any query relating to remote e-voting you may refer the FAQs for Shareholders and refer to e-voting manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no. 1800 1020 990 and 1800224430 or send a request at evoting@nsdl.co.in.
 Pursuant to Section 91 of the Act read with Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 42 of the Listing Regulations, the Register of Members and Share Transfer Books of the Company shall remain closed from Friday, 19th September 2025 to Thursday, 25th September 2025 (both days inclusive) for the purpose of 37th AGM.

સનલાઈટ રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ
 (અગાઉ સનલાઈટ એલુકોપ પ્રાઈવેટ લિમિટેડ તરીકે જાણીતી)
રજિસ્ટર્ડ ઓફિસ: સર્વે નંબર ૨૭૦૦૨ અને પ્લોટ નંબર ૧ સર્વે નંબર ૨૬૭, છછા માર્ગલ, ખેડા, દંતાલી, ગુજરાત, ઈન્ડિયા, ૩૮૭૩૫૦ || **Mobile:** 9426009245
Email: cs@sunliteindustries.com || **Website:** https://www.sunliteindustries.com
CIN: L27200GJ2022PLC134540
ઈ-વોટિંગ માહિતીની નોટિસ
 કંપનીઓ અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૦૮, કંપનીઓ (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૨૦ ની જોગવાઈઓ, કંપનીઓ (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન) સુધારા નિયમો, ૨૦૧૫ અને સંબંધી (ફિનિશિંગ) ઓલિયોગેશન એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ના નિયમ ૪૪ દ્વારા સુધારેલા, કંપની સભ્યોને ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ બપોરે ૦૨:૦૦ વાગ્યે યોજનારી વાર્ષિક જનરલ મીટિંગ (AGM) માં વિચારણા માટે પ્રસ્તાવિત તમામ ઠરાવો પર ઇલેક્ટ્રોનિક રીતે વોટિંગ કરવા માટે ઈ-વોટિંગ સુવિધા પૂરી પાડવા માટે ખુશ છે. કંપનીએ ઈ-વોટિંગ સુવિધા પૂરી પાડવા માટે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ડિન્ડિયા) લિમિટેડ (CDSL) ની સેવાઓનો ઉપયોગ કર્યો છે. ઈ-વોટિંગ સુવિધા. www.evotingindia.com લિંક પર ઉપલબ્ધ છે. કંપની અધિનિયમ, ૨૦૧૩ અને નિયમોની જોગવાઈઓ અનુસાર વિગતો અહીં નીચે મુજબ આપવામાં આવી છે:
 અ) વાર્ષિક જનરલ મીટિંગની નોટિસ મોકલવાની પૂર્ણતા તારીખ: ૦૨/૦૮/૨૦૨૫
 ૨) રિમોટ ઈ-વોટિંગ" શરૂ થવાની તારીખ અને સમય: સોમવાર, ૨૨/૦૮/૨૦૨૫ સવારે ૦૮:૦૦ વાગ્યે
 ૩) "રિમોટ ઈ-વોટિંગ" સમાપ્ત થવાની તારીખ અને સમય: બુધવાર, ૨૪/૦૮/૨૦૨૫ સાંજે ૦૫:૦૦ વાગ્યે
 ૪) ઈ-વોટિંગ માટે કટ-ઓફ તારીખ: શુક્રવાર, ૧/૦૮/૨૦૨૫
 ૫) રિમોટ ઈ-વોટિંગ ૨૪/૦૮/૨૦૨૫ ના રોજ સાંજે ૦૫:૦૦ વાગ્યા પછી મંજૂરી આપવામાં આવશે નહીં.
 ૬) કોઈપણ વ્યક્તિ, જે નોટિસ મોકલ્યા પછી કંપનીના શેર ખરીદે છે અને કંપનીના સભ્ય બને છે અને કટ-ઓફ તારીખ એટલે કે ૧/૦૮/૨૦૨૫ ના રોજ શેર ધરાવે છે, તે helpdesk.evoting@cdsindia.com અથવા cs@sunliteindustries.com પર વિનંતી મોકલીને લોગિન આઈડી અને પાસવર્ડ મેળવી શકે છે. જો કે, જો તમે પહેલાથી જ રિમોટ ઈ-વોટિંગ માટે CDCL સાથે નોંધાયેલા છો, તો તમે તમારો વોટ આપવા માટે તમારા હાલના યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી શકો છો. જો તમે તમારો પાસવર્ડ ભૂલી ગયા છો, તો તમે www.evotingindia.com પર ઉપલબ્ધ "Forgot User Details/ Password" લિંક વ્યવસ્થા ઉપયોગ કરીને તમારો પાસવર્ડ રીસેટ કરી શકો છો અથવા નીચેના દોલક ઈ નંબર : ૧૮૦૦૨૨૫૫૩૩ પર CDCL નો સંપર્ક કરી શકો છો.
 ૭) જે સભ્યોએ AGM પહેલાં રિમોટ ઈ-વોટિંગ દ્વારા પોતાનો વોટ આપ્યો છે તેઓ પણ આગમ દરમિયાન જાણી આપી શકે છે પરંતુ ફરીથી પોતાનો વોટ આપવા માટે હકદાર રહેશે નહીં.
 મીટિંગમાં સ્થળ વોટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે અને જે સભ્યોએ રિમોટ ઈ-વોટિંગ દ્વારા વોટિંગ કર્યું નથી તેઓ AGM માં હાજરી આપી શકશે અને સ્થળ વોટિંગનો ઉપયોગ કરીને વોટિંગ કરી શકશે. કૃપા કરીને તેને રેકૉર્ડ પર લો અને તેની પ્રાપ્તિની સ્વીકૃતિ આપો.

બોર્ડ ઓફ ડિરેક્ટર્સના આદેશથી
સનલાઈટ રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ
 (અગાઉ સનલાઈટ એલુકોપ પ્રાઈવેટ લિમિટેડ તરીકે જાણીતી)
સહી/- પ્રદલાદરાય રામદલાલ હેડા
 પૂર્ણ-સમય ડિરેક્ટર અને ચેરમેન
DIN : 09696242
તારીખ: ૦૨-૦૮-૨૦૨૫ || સ્થળ: ખેડા
સહી/- નીલિન કુમાર હેડા
 મેનેજિંગ ડાયરેક્ટર
DIN : 00383855
By order of the Board of Directors
Trans India House Impex Limited
SD/-
Mruges Ashwin Kumar Vyas
 Company Secretary and Compliance Officer
Membership No: ACS: 49190
Place : Ahmedabad
Date : 03rd September 2025

ચોરોએ મોટી ચોરીની ઘટનાને અંજામ આપ્યો

SBI બેન્ક માંથી ૨ કરોડના ઘરેણાં અને ૮ લાખના રોકડની ચોરી

મધ્યપ્રદેશ, તા.૨ મધ્યપ્રદેશના ઉજ્જૈન સ્થિત મહાનંદા નગરની SBI બેન્કની બ્રાન્ચમાં ચોરોએ મોટી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. બેન્ક બ્રાન્ચ માંથી ચોરો આશરે ૨ કરોડ રૂપિયાની કિંમતના આભૂષણ અને ૮ લાખ રૂપિયા કેશ ચોરી કરીને ફરાર થઈ ગયા છે.

મળતી માહિતી પ્રમાણે મધ્ય પ્રદેશના ઉજ્જૈન સ્થિત મહાનંદા નગરની એસબીઆઈ બેન્કની બ્રાન્ચમાં ચોરોએ મોટી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. બેન્ક બ્રાન્ચમાંથી ચોર લગભગ ૨ કરોડ રૂપિયાની કિંમતના આભૂષણ અને ૮ લાખ રૂપિયા કેશ ચોરી કરીને ફરાર થઈ ગયા છે. ચોરી ની આ ઘટનાની

જાણકારી મળ્યા બાદ ઉજ્જૈન પોલીસમાં હડપ્ત મચી ગયો છે. તો સીસીટીવી ફુટેજમાં ચોરો ચોરીને અંજામ આપતા જોવા મળ્યા છે. મળતી માહિતી પ્રમાણે

આ મામલે પોલીસે બેન્કના દરેક કર્મચારીઓની પૂછપરછ કરી રહી છે

ચોરી કરેલા ઘરેણાં બેન્કમાં રાખેલાં ગોલ્ડ લોનના ઘરેણાં છે. હાલ પોલીસ સીસીટીવીની આધારે ચોરોની તપાસમાં જોતરાઈ છે. ઉજ્જૈન સ્થિત મહાનંદા નગરમાં એક મોટી ચોરીની ઘટના ઘટવા પામી છે. જેમાં બેન્કમાં રાખવામાં આવેલાં ગોલ્ડ લોનના ઘરેણાં

ચોરીને ચોરો ફરાર થઈ ગયા છે. ૨ કરોડના ઘરેણાં અને આશરે ૮ લાખ રોકડ રકમ ચોરી કરીને ફરાર થયા છે. પોલીસને આ વાતની જાણ થયા બાદ તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હાલ પોલીસને એવો શક છે આટલી મોટી ચોરીની ઘટનાને અંજામ આપનાર વ્યક્તિ અંદરનો જ કોઈ હોઈ શકે છે. હાલ પોલીસની ટીમ ઘટના સ્થળે આ બાબતની પૂછતાછ અને તપાસમાં જોડાયેલી છે. ચોરી બાદ સામે આવ્યું છે કે બેન્કમાં ધામા નાખનાર બદમાશોએ બેન્કમાં ગોલ્ડ લોન માટે રાખવામાં આવેલા ઘરેણાની ચોરી કરી છે. આ ઘરેણાં એવા લોકોના હતા.

આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ
 કોર્પોરેટ ઓફિસ: યુનિટ નં. ૮૦૨, નટરાજ રૂસ્તમજી, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઉસ અને એમ. વી. રોડ, અંબેલી (પુઠ) મુંબઈ-૪૦૦૦૬૮.
 નરોડા શાખા: ત્રીજા માળે, સીટી સેન્ટર આર્કડ અને હોમ, એસઆરપી કેમ્પ નજીક, કિશ્ના નગર, નરોડા રોડ, નરોડા, અમદાવાદ-૩૮૨૩૪૫ (ગુજ.)

<div>એપેન્ડિક્સ-૪ કબજાનોટિસ (સ્થાવર સંપત્તિ માટે)</div>				
<p>નીચે સહી કરનાર આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિ. (એએચએફએલ)ના અધિકૃત અધિકારી છે અને બી સિક્યોરિટીઝ ઇન્વેશ્નન એન્ડ રિસ્કમેન્જશન ઓફ ફાનાનાધિયાર એસેટ્સ એન્ડ એન્વીરોનમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્વેસ્ટર્સ સેક્ટર ૨૦૦૨ના સેક્શન ૧૩(૧૨)ને સિક્યોરિટી ઇન્વેસ્ટર્સ (એન્વીરોનમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૩ સાથે વંચાણે લેતા કબજા માળે એ અધિકારોની રૂએ કંપનીના અધિકૃત અધિકારી તરીકે નીચે જણાવેલ (જાહેર/ખાનગી)ખાનગીનાદાર(રો)ને ડિમાન્ડનોટિસ(સો) ઉપર ક્રમી સંબંધિત ડિમાન્ડ નોટિસ(સો)માં ઉલ્લેખ થયેલ રકમો આ નોટિસ મળ્યાની તારીખથી દિન ૬૦માં બરપાઈ કરી જવા કહેવા. દેવાદાર આ રકમ યુકવવામાં નિષ્ફળ જવાને લીધે, અને દેવાદાર(રો)ને આ નોટિસ મળ્યાને જાહેર જતાને નોટિસ આપવામાં આવે છે કે નીચે સહી કરનારે સહાયક કાયદાના સેક્શન ૧૩ના અન્વયે સેક્શન (૪) અને સિક્યોરિટી ઇન્વેસ્ટર્સ (એન્વીરોનમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમો પૈકી નિયમ ૮ સાથે વંચાણે લેતા કેટલા નીચે વર્ણન કરેલ મિકેનિઝમો કમ્પાઈન્ટ થશે. સિક્યોરિટી એક્સચેન્જમાં ઓછાવવાના સંદર્ભે મળવાવાળા સમયમર્યાદા અંગે કાયદાના સેક્શન ૧૩ના અન્વયે સેક્શન (૮)ની જોગવાઈ તરફ દેવાદાર નોંધાન દોરવામાં આવે છે. દેવાદારને વિશેષપૂરે અને જાહેર જતાને સામાન્ય રીતે આ મિકેનિઝમ સાથે કોઈ અવલોકન ન કરવા માટે ચેતવણી આપવામાં આવે છે અને કોઈ પણ આવેલો અવલોકન જરૂર જમતોના વ્યાજસહિતની રકમ સાથે એએચએફએલના ચાઇર્મન આગેન રહેશે.</p>				
<div>નં.</div>	<div>દેવાદાર(રો)સહ-દેવાદારોનું નામ(સો)/ (સામાન્ય નામ)</div>	<div>સિદ્ધાંતો અંગે (સ્થાવર મિલકતો)નું વર્ણન</div>	<div>ડિમાન્ડ નોટિસની તારીખ અને રકમ</div>	<div>કબજા તારીખ</div>
૧	<div>લોન ઘેર નં. ૧૭૨૦૦૦૦૦૩૬૦૮ નંચેલ શાખા)</div> <div>અંતિત વાડીવાલ મહુધિયા (દેવાદાર)</div> <div>જાનવરના પાકવાળા મહુધિયા (સહ દેવાદાર)</div>	<div>તમામ એપાર્ટમેન્ટ કંબેટ નં. ૭૨૫ ૧ થી ૭૨૫ ૨ એ આગુત્તિ એપાર્ટમેન્ટ કંબેટ નં. એ ૪૦૧ આહુતિ એપાર્ટમેન્ટ યોગ્ય માળે,</div> <div>નિવાસ-પાકડવાળા, આટીઓ રોડ નજીક, વસાણ, અમદાવાદ,</div> <div>ગુજરાત-૩૮૨૪૧૮</div> <div>સીમામાં: પૂર્વ: બગીચો, પશ્ચિમ: કંબેટ નં. એ-૪૦૪, ઉત્તર: બ્લોક એ ની સીડી, દક્ષિણ: કંબેટ નં. એ-૪૦૨.</div>	<div>09-09-2024</div> <div>&</div> <div>R 3,99,890/-</div>	31-08-2025

સ્થાન: ગાંધીનગર

તા. ૦૬-૦૮-૨૦૨૫

અધિકૃત અધિકારી

આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિ.